

ક્રિસ્મસ ને નવા વર્ષની પાર્ટીની ઉઝવણી ઈસ્ટ પરમાં

૨૦૧૯ સાલ ખુબજ જલ્દી વટાઈ ગયો અને આ ને ઉઝવવા ઈસ્ટ એરિયા માં પાર્ટી રાખવામાં આવેલ અને સાથે નવા વર્ષને ખુબજ સારી આશા અને આનંદ લઈને આવે તે માટે મોટી સંખ્યા માં મેમ્બરોની હાજરી હતી. બધા ખુબજ આનંદ માં હતા અને બધાને એક બીજાને મળીને વધારે આનંદ આવ્યો. અમારા અધ્યક્ષપતિ શ્રી કિશોરભાઈ ફાધર ક્રિસ્મસ ના વેશ માં આવેલ અને બધાં ને ખુબજ વિનય થી આવકાર આપ્યો. બધા ભેગા થઈને પ્રાર્થના કરી અને બે મિનિટ ની શાંતિ રાખી ને જે આપણને છોડી ને ચાલીયા ગયા હોઈ, બીમાર હોઈ તેવો જલ્દી સાજા થઈ જાય અને દુનિયા માં શાંતિ ફેલાઈ તે માટે બે મિનિટ શાંતિ રાખી.



ઓસ્ટ્રેલિયા માં જે આગ લાગવાથી ખુબજ ખરાબ હાલત થઈ છે, તે જોઈને લોઈ ના આંસુ વહે છે. માણસો ઘરબાર વગરના થઈ ગયા છે. સાથે લાખો પ્રાણીને જીવ જંતુ બરીને દેહ છોડી દીધા. હજિ આ આગ ક્યારે બંધ થશે અને માણસો ખુબજ તકલીફમાં છે. આ દરેકને ધ્યાનમાં રાખવું અને મદદ કરવી તે આપણી પહેલી ફરજ થઈ છે.



ક્રિસ્મસ ને નવા વર્ષના અભિનંદન અને તે ઉજવવા માટે નવી વાનગી બનાવેલ, અને દાબેલી બનાવેલ. બધાને જમવાની મઝા આવી. દાબેલી સાથે ગાજરનો હલવો અને આઈસક્રિમ રાખવામાં આવેલ. બધા સાથે મળીને ઝમીયા અને આનંદ કર્યો. ગરમ ગરમ ચાઈ અને બિસ્કિટ રાખવામાં આવેલ. ખાસ જણાવવાનું કે બીજા પરના મહેમાનો આવેલ અને અમને જોડાઈ અને આવીને ઈસ્ટ એરિયા ને લાભ આપ્યો. મહેમાન માં એક પોટટર્સ બારથી બેન સવિતાબેન હતા અને મારા મોટા બેન સવિતાબેન ની ખુબજ યાદી કરાવી.



જમ્યા પછી મ્યુઝિકલ ચેરની રમત રમિયા અને માણસો પહેલા પછી મહિલાઓ. બધાને તેમનું બાળપણ યાદ આવ્યું. માણસોમાં મહેન્દ્રભાઈ અને મહિલામાં પ્રવીણાબેન શાહ ને ઈનામ મળ્યું, પછી બિંગોની રમત રમ્યા અને તેમાં બધા આતુરતાથી છેલ્લો નંબર ની રાહ જોતા હતા તો વિજયભાઈ બિંગો બોલિયા અને નંબર ફરીથી ચેક કર્યા અને તેમને ઈનામ મળ્યું.



આમ બધા આનંદમાં રમત રમતા અને વાતો કરતા દસ વાગી ગયા અને ઘરે જવાનો સમય થઈ ગયો.

આમ ૨૦૧૯ પૂરો થયો અને ૨૦૨૦ ની વાત જોતા બધા ઘરે ગયા. ખુબજ સરસ વાતાવરણ હતું.

આ વર્ષ પૂરો થયો તો આપ સર્વેને મારા તરફથી મેરી ક્રિસ્મસ અને નવા વર્ષના મારા ખુબજ અભિનંદન. મારા સમિતિના દરેક મેમ્બરને મારા તરફથી અભિનંદન.

જય મહાવીર જય ઓશવાળ.

રિપોર્ટ બાબુલાલ દેવજી શાહ (ઈસ્ટ એરિયા)